

ઘી ન્યુ જર્સી કેમ્પેન કોન્ટ્રીબ્યુશન્સ એન્ડ એક્સપેન્ડિયર્સ રિપોર્ટિંગ એક્ટ, N.J.S.A. 19:44A-37, આ રાજ્યના મતદારોને ગવર્નર પદ માટે ઉમેદવારો વચ્ચેના તેમના નિર્ણયોમાં મદદ કરવા, ઉમેદવારોને 500 શબ્દોથી વધારે નહીં એવું નિવેદન પૂરું પાડવાની પરવાનગી આપે છે. નીચેના નિવેદનો રજુ થયા છે.

## સેઠ કેપર-ડેલ (Seth Kaper-Dale) ગીન

શું તમારી પાસે આ 7 નવેમ્બર માટે વિકલ્પ છે? હા !!

ન્યૂ જર્સીમાં, બન્ને મુખ્ય પક્ષોના રાજકીય બોસ સમાન ભોજન સમારંભના ટેબલ પર જમે છે અને આપણા જેવા બાકીનાને ફક્ત વધેલું ઘટેલું ફેંકે છે. જીવન નિર્વાહ માટે આપણે સંઘર્ષ કરતા રહીએ છીએ.

મધ્ય જર્સીમાં પાદરી અને સામાજિક ન્યાય કાર્યકર્તા તરીકેના સોળ વર્ષોમાં જીવનને સુધારવા માટે મેં બિન નફાકારક સંસ્થાઓ શરૂ અને સંચાલિત કરી છે. આ કાર્યમાં સમાવેશ થાય છે પૂરું પાડવા: a) બેઘર નિવૃત્ત યોદ્ધાઓ માટે પરવડે તેવા ઘરો, દત્તક ઘરોમાંથી બહાર નીકળતી યુવાન સ્ત્રીઓ અને જેલમાંથી છૂટતા લોકો; b) માનસિક આરોગ્ય સેવાઓ; અને c) શાળા પછીના કાર્યક્રમો. શરણાર્થીઓનું પુનઃનિર્માણ અને ઇમિગ્રન્ટ અધિકારોના બચાવમાં અમારું કામ 2012 માં અપકીર્તિ પામ્યું, જ્યારે મારા ચર્ચે નવ ઇન્ડોનિશિયનોને અભયારણ્ય પ્રદાન કર્યું.

ચૂંટણીમાં ઉભેલા મારા સાથી, ન્યુઅર્કના લિસા ડાર્ટોન ફિલ્મ નિર્માતા, સામાજિક મીડિયા વ્યક્તિ અને નિષ્ણાત વિવેચક છે. રાષ્ટ્રીય ટેલિવિઝન પર બ્લેક લાઇવ્સ મેટર ઇવેન્ટનો બચાવ કર્યા પછી એસેક્સ કાઉન્ટી કોલેજે તેણીને નોકરીમાંથી બરખાસ્ત કર્યા. લિસા અને મારું માનવું છે કે સૌથી ઓછામાં ઓછું ધરાવતા વ્યક્તિ જેટલુંજ અમારું રાજ્ય તંદુરસ્ત છે. દરેક વ્યક્તિને સફળ થવાની તક મેળવી જોઈએ. અમારું "લાસ્ટ આર ફર્સ્ટ" પ્લેટફોર્મ નીચેથી ઉભરતી તકોની રચના કરે છે, જેમાં નીચેનાનો સમાવેશ થાય છે:

- જાહેર શિક્ષણ માટે સંપૂર્ણ ભંડોળ. તે સાથે સંબંધિત, બાળકોને ખબર હોવી જોઈએ કે તેઓ રાત્રે ક્યાં ઊઘશે. અમે ભાડાની સહાયતા કાર્યક્રમના વિસ્તરણ દ્વારા પરિવારોને ટેકો આપશું અને બાળ સંભાળ અને શાળા પછીના કાર્યક્રમોમાં વધારો કરશું.
- સ્કૂલ ડિ-સેગ્રેગેશનને પ્રોત્સાહન આપવા માટે રંગભેદ મહોલ્લાઓનો સામનો કરતી વખતે પોસાય તેવા રહેઠાણ માટે વધારાના નાણાં.
- પોલિસિંગ અને સજામાં વંશીય ભેદભાવ દૂર કરવા આપણી ફોજદારી ન્યાય વ્યવસ્થામાં સુધારો, ફરજિયાત ન્યૂનતમનો અંત, અને જેલની મુદતમાંના પહેલા દિવસમાં કેદીના પુનઃ પ્રવેશની શરૂઆત. કેદીઓનો મત આપવાનો અધિકાર રાખવો જોઈએ. અને જેલ મજૂરીને યોગ્ય વેતન મળવુંજ જોઈએ!
- અશ્મિભૂત ઇંધણ પાઈપલાઈનનું વિસ્તરણ અને વાર્ષિક 5% દ્વારા કાર્બન ઉત્સર્જનને દૂર કરીને પર્યાવરણનું રક્ષણ. અમે ગરીબ સમુદાયોને નુકસાન પહોંચાડતા પ્રદૂષકોનો સામનો કરીશું. અમે નવીનીકરણીય ઊર્જાને પ્રોત્સાહન આપીશું જે નવી નોકરીઓનું ઉત્પાદન કરશે.
- વંશીય સફાઈની ટ્રમ્પ નીતિઓ સામે અમારા સમુદાયોમાં બિનદસ્તાવેજી ઇમિગ્રન્ટ્સનો બચાવ. અમે અભયારણ્યને

પ્રોત્સાહન અને વસાહતીઓને ડ્રાઇવિંગ લાઇસન્સ આપશું.

- યુનિયન આયોજન સમર્થન, સામૂહિક સોદાબાજીનો અધિકાર, સ્ત્રીઓ માટે સમાન પગાર, પ્રવર્તમાન વેતન અને લઘુત્તમ વેતન \$ 15 / કલાક.
- બધા માટે સિંગલ-પેઅર મેડિકેરનો અમલ કરવો. હેલ્થકેર પારણાથી કબર સુધીનો અધિકાર છે! સ્વાસ્થ્યસંભાળના નફાના ઉદ્દેશને દૂર કરવાથી નાણાં બચશે. આ મિલકત અને ભાડા કર ઘટાડશે, કોલેજ ખર્ચ ઓછો કરશે અને રાજ્ય પેન્શન બચાવશે.
- આપણા નિષ્કળ પાણી અને પરિવહનના માળખાને પુનઃ બનાવવા, રહેઠાણ પર લેણદારી કબજા રોકવા અને ઓછા વ્યાજના વિદ્યાર્થી લોન આપવા જાહેર બેંકની રચના કરવી જે NJ ને ક્રેડિટ વિસ્તારવા માટે સશક્ત બનાવશે.
- કોર્પોરેટ કલ્યાણને સમાપ્ત કરીને અને નવા આવક કર જૂથો ઉમેરીને, જેથી લાખોમાં કમાતા લોકો સામાન્ય ભલાઈ માટે યોગદાન વધારે.
- અપંગ લોકો, લિંગ પરિવર્તિત વ્યક્તિઓ અને શહેરી યુવાનો સહિત ભેદભાવનો સામનો કરતા સમુદાયો માટે રોજગાર ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રિત કરીને મારીવાના કાયદેસર બનાવવી.
- સ્ત્રીઓ અને બાળકો સામે હિંસાનો સામનો કરવો અને પોતાના શરીર પર નિયંત્રણ રાખવાના મહિલાના અધિકારને બચાવવો.

ફક્ત ગ્રીન પાર્ટી ના સેઠ કેપર-ડેલ અને લિસા ડાર્ડેન સ્ટેટહાઉસ માટે પ્રગતિશીલ ઉમેદવાર છે. નવેમ્બર 7 ના અમને તમારી પસંદગી બનાવો; અમે ટ્રેન્ટનમાં તમારો અવાજ બનીશું.

અમારી ઝુંબેશ વેબસાઇટની મુલાકાત લો: [www.KaperDaleForGovernor.com](http://www.KaperDaleForGovernor.com)